

If you require translation services or a copy of this document in other languages, audio tape, Braille or larger print, please speak to a member of CWP staff or e-mail cwp.info@nhs.net

আপনার অনুবাদ পরিষেবা বা অন্য ভাষায় এই ডকুমেন্টের একটি কপি, অডিও টেপ, অক্ষর বৃদ্ধির লিখনাদির প্রণালী বা বড় আকারের মুদ্রণ প্রয়োজন হলে, অনুগ্রহ করে CWP কর্মীর একজন সদস্যের সাথে কথা বলুন বা cwp.info@nhs.net এ ইমেল করুন

Os oes angen gwasanaethau cyfieithu neu gopi o'r ddogfen hon amoch mewn ieithoedd eraill, tâp awdio, Braille, neu brint brasach, siaradwch ag aelod o staff CWP neu e-bostiwrch cwp.info@nhs.net

જો તમને ભાષાંતર સેવાઓની જરૂર હોય અથવા અન્ય ભાષાઓ, ઑડિયો ટેપ, બ્રેઇલ અથવા મોટા અક્ષરોમાં આ દસ્તાવેજની નકલ જોઈતી હોય તો કૃપા કરીને CWP સ્ટાફના સભ્ય સાથે વાત કરો અથવા cwp.info@nhs.net પર ઇ-મેલ કરો

Jeśli wymagane jest tłumaczenie, lub kopia niniejszego dokumentu w innym języku, na kasecie audio, alfabetem Braille'a lub druk większą czcionką, prosimy o skontaktowanie się z członkiem personelu CWP (Organizacja partnerska krajowego systemu zdrowia regionów Cheshire i Wirral) lub przez pocztę elektroniczną: cwp.info@nhs.net

如果您需要翻译服务或者需要该文件的其它版本, 录音磁带, 盲文或大字体, 请和CWP的一位员工提出, 或者发电邮至 cwp.info@nhs.net

यदि आपको अनुवाद सेवाएँ, या इस दस्तावेज़ की प्रति किसी अन्य भाषा, ऑडियो टेप, ब्रैल या बड़े अक्षरों में चाहिए, तो कृपया CPW स्टाफ के सदस्य से बात करें या cwp.info@nhs.net पर ईमेल करें

Confidentiality

We have a legal duty to keep information about you confidential. We will not disclose information without your consent unless there are exceptional circumstances, such as when the health or safety of yourself or others is at risk.

The information in the leaflet was valid at the date of production 01/04/19 and is due for review on 01/04/21.
Leaflet code: A-PLSC-19- 796



Psychology Leaflet

Saddlebridge
Recovery Centre

Helping people to be
the best they can be

The Psychology Team

Louisa



Christian



Clinical
Psychologist

Clinical
Psychologist



How we can support you

- Reducing psychological distress
- Improving your quality of life
- Supporting you to move forward
- Helping you to work towards future goals
- Supporting you to stay well and prevent relapse

You can talk to us about

- Thoughts
- Feelings e.g. anxiety, mood, anger
- Behaviours
- Sleep
- Drugs and alcohol
- Voices
- Paranoia
- Offences
- Self-esteem
- Relapse prevention
- Other problems

How to speak to us

- Approach Louisa, Christian
- Ask any member of the team
- Speak to us in ward rounds/CPA meetings